

RAN-2408000603030003**S. Y. B.COM (Sem. - III) Examination March - 2026****Advance Accounting & Auditing II (Accountancy & Taxation)****[Total Marks: 50****સૂચના : / Instructions**

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. (કોઈ પણ પાંચ)**10**

- નીચે દર્શાવેલ ખર્ચા માટે વિભાગીય ખાતામાં યોગ્ય વહેંચણીનો આધાર સૂચવો.
અ. આપેલ વટાવ બ. મેનેજરનો પગાર
ક. લાઈટિંગ ડ. સેલ્સમેન કમિશન
- GST સુવિધા પ્રદાતા (GST Suvidha Provider) નો અર્થ જણાવો.
- 1-5-2018 ના રોજ 9% સરકારી સિક્યોરિટી રૂ. 50,000 ની 104 દરે ખરીદવામાં આવી અને રૂ. 300 દલાલી ચુકવાઈ.
આ સિક્યોરિટી પર વ્યાજદર વર્ષે 30મી જૂન અને 31મી ડિસેમ્બરે મળે છે. મૂડીની કિંમત શોધો.
- શ્રી X આકારણી વર્ષ 2024-25 દરમિયાન ભારતમાં 190 દિવસ રહ્યા.
છેલ્લા 7 વર્ષોમાં તેઓ 500 દિવસ રહ્યા હતા. તેમનો અંતિમ રહેઠાણનો દરરજો જણાવો.
- શ્રી A એ ડિસેમ્બર 2024માં રહેણાંક મકાન રૂ. 40,00,000માં વેચ્યું. આ મકાન ડિસેમ્બર 2010માં રૂ. 10,00,000 માં ખરીદેલું હતું. નવા મકાનમાં નફો રૂ. 12,00,000 રોકાણ કર્યું. કરપાત્ર મૂડી નફો શોધો.
- IGST અને UTGST શું છે?
- આકારણી વર્ષ અને પાછલા વર્ષનો અર્થ જણાવો.

પ્ર. 2

1-4-24 શ્રી સમીરે ABC લિમિટેડના 12% ડીબેન્યર્સ રૂ. 1,00,000 (અસલ કિંમત) રાખ્યા હતા, જેનું ચોપડા કિંમત રૂ. 1,04,000 હતું. વ્યાજ 30મી જૂન અને 31 મી ડિસેમ્બરે મળે છે. નીચેના વ્યવહાર થયા:

તારિખ	અસલ કિંમત	દર	વિશેષ નોંધ
1-6-24	25,000	120	વેચાણ (વ્યાજ સહિત)
1-8-24	40,000	110	ખરીદી (વ્યાજ સહિત)

1-10-24	30,000	105	વેચાણ (વ્યાજ બાદ)
1-12-24	50,000	90	ખરીદી (વ્યાજ બાદ)

દરેક ખરીદી અને વેચાણ પર 1% દલાલી ચૂકવાઈ. સરેરાશ પદ્ધતિ પ્રમાણે 12% ડિબેન્ચર ખાતું તૈયાર કરો.

14

અથવા

- પ્ર. 2. રોલન બે ડિપાર્ટમેન્ટ વિભાગ અ અને વિભાગ બ ધરાવતી એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે. નીચે 31-03-2025 સુધીનું ટ્રાયલ બેલેન્સ આપેલ છે:

કાચું સરવૈયું

ઉધાર બાજુ	રકમ (₹)	જમા બાજુ	રકમ (₹)
શરૂનો સ્ટોક : અ	17,000	વેચાણ : અ	60,800
શરૂનો સ્ટોક : બ	14,500	વેચાણ : બ	51,250
ખરીદી : અ	35,400	મળેલ વટાવ	650
ખરીદી : બ	30,200	પરચુરણ લેણદાર	18,600
મજૂરી : અ	8,200	રોલનનું મૂડી ખાતું	47,660
મજૂરી : બ	2,700		
જાહેરાત	3,680		
ભાડું, દર અને વીમો	9,390		
અન્ય ખર્ચ	3,600		
પગાર	3,000		
લાઈટિંગ	2,100		
વટાવ આપેલ	2,220		
આવક માલ ગાડા ભાડું	2,340		
ફર્નિચર અને ફિક્સર્સ	3,000		
પ્લાન્ટ અને મશીનરી	21,000		
પરચુરણ દેવાદારો	6,060		
રોલનનો ઉપાડ	4500		
હાથમાં રોકડ	170		
બેંક સિલક	9,900		
કુલ	1,78,960	કુલ	1,78,960

વધારાની માહિતી :

1. ભાડું, દર અને ઈન્શ્યોરન્સ, અન્ય ખર્ચ, લાઈટિંગ, પગાર અને આવક માલ ગાડા ભાડુંનું વહેંચણા અ 2/3 અને બ 1/3 ના પ્રમાણમાં કરવો.
2. જાહેરાતનો ખર્ચ બંને વિભાગમાં સમાન વહેંચવો.
3. વટાવ આપેલ અને પ્રાપ્ત થયેલનો વહેંચણા વેચાણ અને ખરીદીના પ્રમાણમાં કરવો.
4. ફર્નિચર અને ફિટિંગ્સ તેમજ પ્લાન્ટ અને મશીનરી પર 10% વાર્ષિક ઘસારો ગણો અને તેની વહેંચણી વિભાગ અ અને બ માટે ક્રમશઃ 3/4 અને 1/4 પ્રમાણે કરવો.
5. વિભાગ બ દ્વારા વિભાગ અ ને આપવામાં આવેલી સેવા માટેના ₹500 વેતનમાં સમાવિષ્ટ છે.
6. 31-3-2025 ના રોજ સ્ટોક નીચે મુજબ છે:
 - ° વિભાગ અ : ₹16,740
 - ° વિભાગ બ : ₹12,050
7. વર્ષ દરમિયાન સ્થાવર સંપત્તિમાં કોઈ ફેરફાર થયો નથી.

પ્ર. 3. અ. શ્રી રોલન વિશે નાણાકીય વર્ષ 2024 - 25 ની વિગતો મુજબ કરપાત્ર મુડી નક્કો અને કર જવાબદારી આકારણી વર્ષ 2025-2026 માટે શોધો.

08

1. 1-4-2008 એ પ્લોટ રૂ. 2,00,000 માં ખરીદ્યો.
 - ° વ્યાજબી બજાર કિંમત 1-4-2001 રૂ.80,000
 - ° વેચાણ 1-6-2024 રૂ.12,00,000.
2. 1-5-2023 એ લિસ્ટેડ શેર રૂ. 1,50,000 માં ખરીદ્યા, 15-4-2024 એ રૂ. 2,00,000માં વેચાયા (STT ચૂકવાયેલ)
3. 10-6-2012 એ સોનું રૂ. 3,00,000, માં લીધું, 5-07-2024 એ રૂ. 8,00,000 માં વેચાયું.
ખર્ચ કુગાવો સૂચકાંક (CII):
 - 2001-02 = 100
 - 2008-09 = 137
 - 2012-13 = 200
 - 2023-24 = 348
 - 2024-25 = 363

બ. GST કાઉન્સિલ પર નોંધ લખો.

06

અથવા

પ્ર. 3. અ. કર આયોજન અને કર સંચાલન વચ્ચેનો તફાવત સમજાવો.

06

બ. શ્રી એ ના નાણાકીય વર્ષ 2024-25 માં નીચેના વ્યવહારો છે.

08

ખરીદની તારિખ	સંપત્તિ	ખરીદી કિંમત (₹)	વેચાણની તારિખ	વેચાણ કિંમત (₹)	ટ્રાન્સફર ખર્ચ
10-06-2012	રહેણાંક પ્લોટ	5,00,000	15-07-2024	16,00,000	40,000
05-05-2020	શેર (લિસ્ટેડ)	2,50,000	20-07-2024	4,00,000	5,000
12-04-2018	સોનું	3,00,000	25-05-2024	5,20,000	10,000

CII નીચે મુજબ છે:

2011-12	184	2018-19	280	2020-21	301
2012-13	200	2019-20	289	2024-25	363

કરપાત્ર મૂડી નફો શોધો. આકારણી વર્ષ 2025-26.

પ્ર. 4. નીચેના વિષયો પર ટૂંકનોટ લખો. (કોઈ પણ ત્રણ)

12

1. GST રજિસ્ટ્રેશન
2. GST ના લાભો
3. વ્યક્તિ
4. કુલ આવકની ગણતરી (Computation of Total Income)
5. આંતર વિભાગીય ટ્રાન્સફર

ENGLISH VERSION

Q. 1. Answer the following questions. (Any Five)

10

1. Suggest suitable basis for allocation of following expenses under Departmental Account:
(I) Discount Allowed (II) Managers Salary (III) Lighting (IV) Salesman Commission
2. What do you mean by GST Suvidha Provider?
3. On 1-5-18, 9% government securities of Rs.50,000 was purchased at 104 price and Rs.300 paid as brokerage. Interest on this security is paid on 30th June, and 31 December every year. You have to find out only the capital price.
4. Mr. X stayed in India for 190 days during previous year 2024-25. He was stayed in India for 500 days during last 7 years. Find out his final residential status.
5. Mr A sold residential house in December 2024 for ₹40,00,000. This house was purchased by him in December 2010 for ₹10,00,000. Amount of profit ₹12,00,000 is invested in purchase of new house. Compute his taxable capital gain. CII are as follows:

6. What is IGST & UTGST?
7. What do you mean by assessment & previous year?

Q. 2 On 1-4-24 Shri Samir held 12% Debentures of ABC Ltd. Face value of which is Rs 1,00,000 and book value is Rs.1,04,000. Interest on this debenture is paid on 30th June and 31st December. Transactions for the year ended on 31-3-25 were as under:

Date	Face value	Rate	Remarks
1-6-24	25,000	120	Sales cum Interest
1-8-24	40,000	110	Purchase Cum Interest
1-10-24	30,000	105	Sales Ex Interest
1-12-24	50,000	90	Purchase Ex Interest

Brokerage is paid at 1% on every transaction of purchase and sale. Prepare 12% Debentures account by applying average method.

14

OR

Q. 2. Rohan run a departmental store having Dept. A and Dept. B. Trial Balance as on 31-03-2025 is given below:

Trial Balance

Debit Balance	Amt. (₹)	Credit Balance	Amt. (₹)
Opening Stock: A	17,000	Sales: A	60,800
Opening Stock: B	14,500	Sales: B	51,250
Purchases: A	35,400	Discount received	650
Purchases: B	30,200	Sundry Creditors	18,600
Wages: A	8,200	Rohan's Capital A/c	47,660
Wages: B	2,700		
Advertisement	3,680		
Rent, rates & Insurance	9,390		
Sundry Expenses	3,600		
Salary	3,000		
Lighting	2,100		
Discount allowed	2,220		
Carriage inward	2,340		
Furniture & Fittings	3,000		
Plant & Machinery	21,000		
Sundry Debtors	6,060		
Rohan's Drawing	4,500		

Debit Balance	Amt. (₹)	Credit Balance	Amt. (₹)
Cash on Hand	170		
Bank balance	9,900		
Total	1,78,960	Total	1,78,960

Additional Information:

1. Rent, taxes & insurance, Sundry expenses, Lighting, Salary and Carriage inward are to be apportioned between the two departments in the proportion of 2/3 and 1/3 respectively.
2. Advertisement expenses are to be allocated equally.
3. Discount allowed and received are to be allocated on the basis of departmental sales and purchases.
4. Depreciate Furniture and Fittings as well as plant & machinery at 10% p.a. and allocate it to two departments as A 3/4 and B 1/4.
5. Rs.500 charged by Department B to Department A for services rendered is included in wages.
6. Stock on 31-3-25 was as follows:
Dept. A 16740 Dept. B 12050
7. There have been no changes in fixed assets during the year.

Q. 3. A. Mr. Rohan provides the following details for FY 2024-25. Compute taxable capital gain & tax liability of Mr. Rohan for A.Y. 2025-26.

08

1. Purchased a plot of land on 1-4-2008 for ₹2,00,000.
 - o FMV as on 1-4-2001 ₹80,000
 - o Sold on 1-6-2024 for ₹12,00,000.
2. Purchased listed shares on 1-5-2023 for ₹1,50,000 and sold on 15-4-2024 for ₹2,00,000 (STT paid).
3. Gold jewellery purchased on 10-6-2012 for ₹3,00,000, sold on 5-07-2024 for ₹8,00,000.

Cost Inflation Index (CII):

- 2001-02 = 100
- 2008-09=137
- 2012-13 = 200
- 2023-24 = 348
- 2024-25 = 363

B. Write a note on GST Council.

06

OR

Q. 3. A. Differentiate between Tax Planning & Tax Management. 06

B. Mr. A has the following transactions in the financial year 2024-25: 08

Date of Purchase	Asset	Purchase Price(₹)	Date of Sale	Sale Price (₹)	Transfer Exp.
10-06-2012	Residential Plot	5,00,000	15-07-2024	16,00,000	40,000
05-05-2020	Shares (Listed)	2,50,000	20-07-2024	4,00,000	5,000
12-04-2018	Gold	3,00,000	25-05-2024	5,20,000	10,000

CII are as follows:

2011-12	184	2018-19	280	2020-21	301
2012-13	200	2019-20	289	2024-25	363

Find the taxable capital gain for the A.Y. 2025-26.

Q. 4. Write a note on: (Any three) 12

1. GST Registration
2. Benefits of GST
3. Person
4. Computation of Total Income
5. Inter Department Transfer